

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૧/૦૭/૨૦૧૮ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૨૪૦/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૬ કેસ કરી, ૫૩ વ્યક્તિઓને ઝડપી, ૨૭૫ લીટર દેશી દારૂ, ૬૧૬ બોટલ ઇંગ્લીશ દારૂ, ૮૫ કવોટર ઇંગ્લીશ દારૂ, ૨૪ બિયર ટીન ૦૧ કાર અને ૦૧ સ્કુટર કબજે કર્યું હતું. તેમજ જુગારધારા હેઠળ ૦૭ કેસ કરી ૨૦ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૪૦,૭૧૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૨૪૧/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૮,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૫૨૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૩૧ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૫ વ્યક્તિની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૧૨૪૨ /૧૮

**વસ્ત્રાપુર :** નિલેશભાઈ હરસુખભાઈ વાઢેર (ઉ.વ.૪૦)(રહે,સત્યમ સ્કાયલાઈન, ટોરેન્ટ પાવર સામે, નારણપુરા) એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩૦/૦૬/૨૦૧૮ બપોરના ૨/૧૫ થી ૨/૩૦ વાગ્યા દરમિયાન બોડકદેવ એસ.જી.હાઈવે ગોરધનથાળ હોટલ ની સામે રોડ ઉપર નિલેશભાઈ પોતાની હોંડા કંપનીની WR-V મોડલની કાર નંબર જીજે-૦૧-એચ.વી-૬૦૮૫ કિંમત રૂપિયા ૮,૫૦,૦૦૦/- પાર્ક કરવા જતા હતા દરમિયાન એક અજાણ્યો ઇસમ (જેના નામ સરનામાની ખબર નથી)(૩૮ થી ૪૨ વર્ષના આશરાનો) પોતાની વોલેટ પાર્કિંગ વાળા ઇસમ તરીકે ખોટી ઓળખ આપી, નિલેશભાઈ પાસેથી કાર લઈ નાસી જઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.કે.મકવાણા ચલાવે છે.

**કૃષ્ણનગર :** હેતલાબહેન વા/ઓ નરેંદ્રભાઈ પ્રજાપતી (ઉ.વ.૩૭) (રહે,વિઠલવેલો સીટી દહેગામ રોડ નરોડા)એ તા.૩૦/૬/૧૮ ના રોજ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૫/૦૫/૧૮ થી આજદીન સુધીના સમયગાળા દરમિયાન આરોપીણ રેખાબેન બીપીનકુમાર પ્રજાપતી (રહે,રાધીકાવિહાર ફ્લેટ બાપાસીતારમ નવા નરોડા) એ “અમોને રૂપિયા આપો એ નાઇસ કંપની મા આપીએ છિએ અને આ રૂપિયા કરણ ગોલ્ડ અને બીટકોઇન મા રોકાણ કરે છે અને આ રૂપિયા કંપનીમાં રોજના રોજ ડબલ થઇ જાય છે તેમજ એકાદ મહીના બાદ રૂપિયા ડબલ કરીને આપીએ છિએ” તેવી લોભામણી સ્કીમ બતાવી, હેતલાબહેનને વિશ્વાસમાં લઇ, તેઓ પાસે થી ટુકડે-ટુકડે રોકડ રૂપિયા ૨૦,૫૦,૦૦૦/- મેળવી લઇ, પરત નહી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એન.પી.મારૂ ચલાવે છે.

ઘરફોડ ચોરી :-

સમાચાર યાદી નં.૧૨૪૩ /૧૮

રાણીપ : જયરામભાઈ અમથાભાઈ દેસાઈ (ઉ.વ.૩૮)(રહે,હિમાલયા મોલ ચોકીદારની ઓરડી, પ્રબોધરાવળ સર્કલ પાસે રાણીપ) એ તા.૩૦/૬/૧૮ નારોજ રાણીપ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૩/૦૪/૨૦૧૮ રાતના ૧૧/૦૦ થી ૧૧/૩૦ સુધીના સમયગાળા દરમ્યાન પોતાની ઓરડી નું તાળુ તોડી, અજાણી વ્યક્તિ ઓરડીમા પ્રવેશ કરી, તીજોરીમાંથી સોના-ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૫૫,૦૦૦/- અને રોકડ રૂપિયા ૩,૦૦૦/- મળી કુલ રૂપિયા ૫૮,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.આર.ચાવડા ચલાવે છે.

સોનાની ચેઇન ખેંચી તોડી લઈ ગયા :-

સમાચાર યાદી નં.૧૨૪૪ /૧૮

સોલા હાઇકોર્ટ: જાગૃતીબહેન વા/ઓ ચેતનભાઈ પટેલ (ઉ.વ.૩૪)(રહે,શ્રીનાથ એવન્યુ આઇ.સી.બી. સીટીની બાજુમા વંદેમાતરમ રોડ ચાંદલોડીયા) એ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩૦/૦૬/૨૦૧૮ ના કલાક ૯/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘર નજીકથી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ જાગૃતીબહેનના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૧૮,૦૦૦/- ખેંચી તોડી લઈ નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.જે.વસાવા ચલાવે છે.

વાહન ચોરી :-

સમાચાર યાદી નં.૧૨૪૫ /૧૮

સોલા હાઇકોર્ટ : અંકીતભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ (રહે, અવધપાર્ક લેન્ડ ફ્લેટ, જલારામ પરોઠા હાઉસની ગલીમાં, સાયન્સ સીટી રોડ) એ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૯/૦૬/૨૦૧૮ રાતના ૦૦/૪૫ વાગ્યા દરમ્યાન પોતાના ઘર નજીક પાર્ક કરેલ પોતાની હોંડા સીટી કાર નંબર જીજે-૦૧-આર.એક્સ.-૧૨૧૫ પાર્ક કરી મુકી હતી જેની કોઈ અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી બી.એમ.પરમાર ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૧૨૪૬/૧૮

કૃષ્ણનગર : જગદીશભાઈ હરીભાઈ શ્રીમાળી (ઉ.વ.૨૫)(રહે,ગુ.હા.બોર્ડ મકાન, કૃષ્ણનગર) એ અગમ્ય કારણોસર તા.૩૦/૬/૧૮ બપોરના ૩/૨૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી નરેન્દ્રસિંહ ખુમાનસિંહ ચલાવે છે.

શહેરકોટડા : રસિકભાઈ સોમનાથ પંચાલ (ઉ.વ.૫૩)(રહે,રમેશનગર સોસાયટી ઇન્ડીયા કોલોની પાછળ બાપુનગર) એ અગમ્ય કારણોસર તા.૩૦/૬/૧૮ ના કલાક ૧૧/૦૫ વાગ્યાના સુમારે પોતાની દુકાન યાદવ એસ્ટેટ ખાતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી હમિરભાઈ અળસીભાઈ ચલાવે છે.

સાબરમતી : ઈલેયરાજા ચિનાપન આદિદ્રવીડ (ઉ.વ.૩૦)(રહે.ઈન્દીરાનગર કાળીગામ ઈરાનગર સાબરમતી) ઁ બેકારી થી કંટાળી જઈ તા.૩૦/૬/૧૮ રાતના ૯/૧૫ વાગ્યા પહેલા પોતાના ઘરે સાડી વડે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે સાબરમતી પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી શનાભાઈ ધુળાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાઈ શહેર.  
પોલીસ કમિશનર વતી.